https://archive.org/details/bk1482/page/n0/mode/1up

2012-04-30 -News Article -Surat Satpanth Function (1482)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

...રાખી IPLની મેચ ...નાર પકડાયો

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી અલગ અલગ ૧૦ મોબાઈલ ફોન, ટીવી, નોટબુક, ...રોકડ રકમ મળી કુલ રૂ. ૬૩,૪૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

તપાસકર્તા પો.સ.ઈ. પી.બી. ગઢવીના જણાવ્યા મુજબ ધવલ સને ૨૦૧૦માં પણ ક્રાઈમ બ્રાંચના હાથે સટ્ટા બેટીંગ કરતા પકડાયો હતો. તે મૂળ જમીન દલાલ છે અને જયારે જયારે પણ રસપ્રદ મેચો રમાતી હોય ત્યારે સટ્ટો રમાડે છે. હાલની આઈપીએલ મેચ પર દરેક રન અને ઓવર પર સટ્ટો રમાડતો હતો. વળી જ્યારથી આઈપીએલની મેચની શરૂઆત થઈ છે ત્યારથી પાલ સુડા બિલ્ડીંગમાં રૂમ ભાડે રાખ્યો હતો.

...પાલમાં ...૩૫ રૂમ ...રહ્યો છે ...ને અંગત ...શનિવારની ...ધવલ ...શ્રીપદ ...નહેર, ...સુપર ...લાઈવ

...લીયાવાલાને પોલીસે દબોચી લીધો: ...૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે

...શિક્ષિકાને ધક્કો ...ઈ ચેઈનની તફડંચી

સુરત, રવિવાર

...પૂછવાના બહાને એક ચેઈન સ્નેચરે ધક્કો મારી ...૦,૦૦૦ની સોનાની ચેઈન આંચકી લઈ બીજા ચેઈન ...છૂટવાનો બનાવ બન્યો હતો.

...ને ઈન્દુબેન પંડયાને રોકી ચેઈન ...સાગરિત સાથે બાઈક પર ફરાર

ઘર કયાં છે? એમ કહી તેનું સરનામું પૂછયું હતું. ઈન્દુબેન કંઈ બોલે તે પહેલાં ધક્કો મારી તેમને મોપેડ પરથી નીચે પાડી દઈ પેલો વ્યક્તિ ગળામાંથી પેન્ડલ સાથેની સોનાની ચેઈન

હકારાત્મક પરિવર્તન લાવનાર પ્રેરણાદાયક કાર્યક્રમ
FREE SEMINAR
Dr. Adhia's Mind Power & Money WORKSHOP
...સવારે નાનપુરા સાંજે ૭.૩૦ થી ૯.૩૦
...રતી સ્કૂલ, ગાંધીસ્મૃતિ હોલની સામે
9898999383, 9687033031

તોડીને થોડે દૂર ઉભા રાખેલા બીજા અજાણ્યાની મોટરસાયકલ પર બેસીને ભાગી છૂટયો હતો. બનાવ અંગે ઈન્દુબેને અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પો.ઈ. એસ.જે. બલાટે તપાસ હાથ ધરી છે.

...ફરતો SMS ...કોમર્સને ઝી ...કોને આભારી?

સતપંથ સનાતન ધર્મના સર્વે ભગવા સમસ્તના સાનિધ્યમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. (તસ્વીર: દિપક પવાર)

પોલીસે ધરપકડ કરવાની વાત કરતાં

સતપંથના કાર્યક્રમના વિરોધની વાત કરનારા પાણીમાં બેસી ગયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં આજે યોજાયેલા સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા સમાજના સ્નેહમિલન કાર્યક્રમનો વિરોધ કરવા માટે મોટે ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કાર્યક્રમનો વિરોધ કરાશે તો ધરપકડ કરવામાં આવશે તેવી વાત કરતાં વિરોધ કરનારાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ પડતો મુક્યો હતો.

સુરતના વૈદિક સનાતન પ્રતિષ્ઠાન તથા પરશુરામ સેના દ્વારા સુરતમાં સતપંથ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનો મોટા ઉપાડે વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતપંથ સમાજ સનાતન ધર્મ નહીં પરંતુ શિયા મુસ્લિમનો સમુદાય હોવાનું કહેવામાં આવ્યું હતું. સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અવનિષ પંડ્યાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ ભોળા હિન્દુઓને વટલાવવા માટેનો કાર્યક્રમ છે. સતપંથમાં માનનારો વર્ગ મુસલમાન રીત-રીવાજોવાળો છે. અગાઉ નિર્દોષોને વટલાવેલા અને હજી પણ ગુમરાહ કરવા કાર્યવાહી કરવામા આવે છે. આ સતપંથીઓને કોઈ ઐતિહાસિક સમર્થન નથી કે બ્રાહ્મણ સંસ્થા કે વેદનું પણ સમર્થન નથી. ઈમામ શાહ અને હજરત અલી જેવા આ સતપંથના કહેવાતા ગુરુઓ છે અને સૈયદો છે. સતપંથ તથા સનાતન ધર્મ બન્નેને સંબંધ નથી.

છતાં પણ સતપંથીઓ હિન્દુ ધર્મનો ભાગ ...હિન્દુ ...તત્વો ...કૃતિ કરી રહ્યા ...ની સામે પરશુરામ સેના તથા વૈદિક સનાતમ પ્રતિષ્ઠાનમ દ્વારા વિરોધ કરવામાં આવે છે. આજે તા. ૨૯ને રવિવારે કાર્યક્રમ યોજાઈ તે પહેલાં કાર્યક્રમને રોકવા માટે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવા ઉપરાંત આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ સમારંભના સ્થળ પર જઈને પણ કાર્યક્રમ રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

આવી મોટા ઉપાડે જાહેરાત કરાતા સતપંથ સમાજનો કાર્યક્રમમાં આજે વિઘ્ન આવે તેવી શક્યતા હતી. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે વિરોધ કરનારાઓને ચીમકી આપી હતી કે આ કાર્યક્રમમાં પોલીસના અધિકારીઓ, ભાજપના નેતાઓ હાજર રહેનાર છે. તેથી જો તમે ખોટી રીતે વિરોધ કરશો તો તમારી ધરપકડ કરવામાં આવશે. ધરપકડના વાત કરતાંની સાથે જ વિરોધ કરનારાઓએ વિરોધ કરવાનું માંડી વાળ્યું છે. જોકે, હવે આગામી દિવસોમાં સતપંથીઓના વિરોધમાં કાર્યક્રમ આપવા માટેની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સમારંભ સ્થળ પર જઈને પણ કાર્યક્રમને રોકવાની મોટા ઉપાડે જાહેરાત કરનારાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ પણ પડતો મૂક્યો

મહેશ ગોધાણીને ફાંસો આપનાર ચીમન ચૌધરીની ધરપકડ

સુરતના બે મિત્રની હત્યા નાણાંમાં

realpatidar.com

https://archive.org/details/bk1482/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1482/page/n2/mode/1up

2012-04-30 -News Article -Surat Satpanth Function (1482)

realpatidar.com

રાખી IPLની મેચ ...માડનાર પકડાયો

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી અલગ અલગ ૧૦ મોબાઈલ ફોન, ટીવી, નોટબુક, ...સ્ટેશન, રોકડ રકમ મળી કુલ રૂ. ૬૩,૪૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

તપાસકર્તા પો.સ.ઇ. પી.બી. ગઢવીના જણાવ્યા મુજબ ધવલ સને ૨૦૧૦માં પણ ક્રાઈમ બ્રાંચના હાથે સટ્ટા બેટીંગ કરતા પકડાયો હતો. તે મૂળ જમીન દલાલ છે અને જયારે જયારે પણ રસપ્રદ મેચો રમાતી હોય ત્યારે સટ્ટો રમાડે છે. હાલની આઈપીએલ મેચ પર દરેક રન અને ઓવર પર સટ્ટો રમાડતો હતો. વળી જ્યારથી આઈપીએલની મેચની શરૂઆત થઈ છે ત્યારથી પાલ સુડા બિલ્ડીંગમાં રૂમ ભાડે રાખ્યો હતો.

...લીયાવાલાને પોલીસે દબોચી લીધો: ...ત ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે

...શિક્ષિકાને ધક્કો ...ઈ ચેઈનની તફડંચી

સુરત, રવિવાર

...નું પૂછવાના બહાને એક ચેઈન સ્નેચરે ધક્કો મારી ...૦,૦૦૦ની સોનાની ચેઈન આંચકી લઈ બીજા ચેઈન ...ની સાથે છૂટવાનો બનાવ બન્યો હતો.

...ને ઈન્દુબેન પંડયાને રોકી ચેઈન સાગરિત સાથે બાઈક પર ફરાર

ઘર ક્યાં છે? એમ કહી તેનુ સરનામું પૂછયું હતું. ઈન્દુબેન કંઈ બોલે તે પહેલાં ધક્કો મારી તેમને મોપેડ પરથી નીચે પાડી દઈ પેલાં વ્યક્તિ ગળામાંથી પેન્ડલ સાથેની સોનાની ચેઈન તોડીને થોડે દૂર ઉભા રાખેલા બીજા અછોડાતોડની મોટરસાયકલ પર બેસીને ભાગી છૂટયો હતો. બનાવ અંગે ઈન્દુબેને અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પો.ઈ. એસ.જે. બલોચે તપાસ હાથ ધરી છે.

હકારાત્મક પરિવર્તન લાવનાર પ્રેરણાદાયક કાર્યક્રમ
FREE SEMINAR
Dr. Adhia's Mind Power & Money WORKSHOP
મની વર્કશોપ દ્વારા સહેલાઈથી સમૃદ્ધિનું સર્જન કરવાનું વિજ્ઞાન અને કળા શીખો
...વારે નાનપુરા સાંજે ૭.૩૦ થી ૯.૩૦
...ારતી સ્કુલ, ગાંધીસ્મૃતિ હોલની સામે
9898999383, 9687033031

...ાં ફરતો SMS
...ફ કોમર્સને ઝી ...ોને આભારી?



સતપંથ સનાતન ધર્મના સર્વે ભગવા સમસ્તના સાનિધ્યમાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. (તસ્વીર: દિપક પવાર)

પોલીસે ધરપકડ કરવાની વાત કરતાં

સતપંથના કાર્યક્રમના વિરોધની વાત કરનારા પાણીમાં બેસી ગયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં આજે યોજાયેલા સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા સમાજના સ્નેહમિલન કાર્યક્રમનો વિરોધ કરવા માટે મોટે ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કાર્યક્રમનો વિરોધ કરાશે તો ધરપકડ કરવામાં આવશે તેવી વાત કરતાં વિરોધ કરનારાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ પડતો મુક્યો હતો.

સુરતના વૈદિક સનાતન પ્રતિષ્ઠાન તથા પરશુરામ સેના દ્વારા સુરતમાં સતપંથ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનો મોટા ઉપાડે વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતપંથ સમાજ સનાતન ધર્મ નહીં પરંતુ શિયા મુસ્લિમનો સમુદાય હોવાનું કહેવામાં આવ્યું હતું. સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અવનિષ પંડ્યાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ ભોળા હિન્દુઓને વટલાવવા માટેનો કાર્યક્રમ છે. સતપંથમાં માનનારો વર્ગ મુસલમાન રીત-રીવાજોવાળો છે. અગાઉ નિર્દોષોને વટલાવેલા અને હજી પણ ગુમરાહ કરવા કાર્યવાહી કરવામા આવે છે. આ સતપંથીઓને કોઈ ઐતિહાસિક સમર્થન નથી કે બ્રાહ્મણ સંસ્થા કે વેદનું પણ સમર્થન નથી. ઈમામ શાહ અને હજરત અલી જેવા આ સતપંથના કહેવાતા ગુરુઓ છે અને સૈયદો છે. સતપંથ તથા સનાતન ધર્મ બન્નેને સંબંધ નથી.

છતાં પણ સતપંથીઓ હિન્દુ ધર્મનો ભાગ ... હિન્દુ તત્વો પ્રવૃત્તિ કરી રહ્યા ... સામે પરશુરામ સેના તથા વૈદિક સનાતન પ્રતિષ્ઠાનમ દ્વારા વિરોધ કરવામાં આવે છે. આજે તા. ૨૯ને રવિવારે કાર્યક્રમ યોજાઈ તે પહેલાં કાર્યક્રમને રોકવા માટે પોલીસ કમિશનરને ફરિયાદ કરવા ઉપરાંત આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ સમારંભના સ્થળ પર જઈને પણ કાર્યક્રમ રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

આવી મોટા ઉપાડે જાહેરાત કરાતા સતપંથ સમાજનો કાર્યક્રમમાં આજે વિઘ્ન આવે તેવી શક્યતા હતી. પરંતુ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે વિરોધ કરનારાઓને ચીમકી આપી હતી કે આ કાર્યક્રમમાં પોલીસના અધિકારીઓ, ભાજપના નેતાઓ હાજર રહેનાર છે. તેથી જો તમે ખોટી રીતે વિરોધ કરશો તો તમારી ધરપકડ કરવામાં આવશે. ધરપકડના વાત કરતાંની સાથે જ વિરોધ કરનારાઓએ વિરોધ કરવાનું માંડી વાળ્યું છે. જોકે, હવે આગામી દિવસોમાં સતપંથીઓના વિરોધમાં કાર્યક્રમ આપવા માટેની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સમારંભ સ્થળ પર જઈને પણ કાર્યક્રમને રોકવાની મોટા ઉપાડે જાહેરાત કરનારાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ પણ પડતો મૂક્યો

મહેશ ગોધાણીને ફાંસો આપનાર ચીમન ચૌધરીની ધરપકડ

સુરતના બે મિત્રની હત્યા નાણાંમાં

realpatidar.com